



ભાજપ સરકારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫,૨૬૯ ભરતી મેળા દ્વારા ૧૦,૦૯,૬૫૨ યુવાનોને નોકરી અને મુદ્રા યોજનામાં છેલ્લા ૪ વર્ષમાં ૪૪,૨૦,૬૨૩ લોકોને રૂ.૩૦,૪૬૮ કરોડનું ધિરાણ કરીને લાભાર્થીઓને રોજગારી આપેલ છે. - ભરત પંડ્યા

વિપક્ષના નેતાશ્રીને ભરત પંડ્યાનો જવાબ

પુનઃપરીક્ષાનો નિર્ણય અને કસૂરવારોને પકડીને ગેરરીતી કરનારા ગુનેગારોનું નસીબ ફૂટ્યું છે પરંતુ હોંશિયાર, પરિશ્રમી અને પ્રમાણિક પરીક્ષાર્થીઓનાં નસીબને સરકારે પુનઃપરીક્ષા માટે અકબંધ રાખ્યું છે. - ભરત પંડ્યા

દરેક ને સરકારી નોકરી મળે તેવી વધુ ઈચ્છા હોય છે. તે તેમનો અધિકાર પણ છે. તે અધિકારને કોંગ્રેસે સંખ્યાત્મક રીતે દર્શાવીને ઉશ્કેરાટ અને અપપ્રચાર ફેલાવવામાં ઉપયોગ ન કરવો જોઈએ. - ભરત પંડ્યા

સરકારનાં નોકરી આપવાનાં પ્રયાસની પણ કોંગ્રેસ નિંદા કરે છે તે કેટલું યોગ્ય છે ? - ભરત પંડ્યા

પારદર્શિતા, ભ્રષ્ટાચાર સામે એક્શન અને વાઈબ્રન્ટનો વિરોધ કરનાર કોંગ્રેસ નકારાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તિ કરી રહી છે. - ભરત પંડ્યા

ભાજપ પ્રદેશ પ્રવક્તાએ વિપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ રોજગારી અંગે કરેલાં નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું, કે કોંગ્રેસ હમેશાં ઉશ્કેરાટ અને ભડકાવવાની વાત કરીને પોતાનાં રાજકીય રોટલા શેકવાની પ્રવૃત્તિ કરી રહી છે. કેન્દ્રમાં કોંગ્રેસનાં શાસન વખતે પણ ગુજરાત રોજગારીમાં પ્રથમ નંબરે રહ્યું હતું. અને આજે પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં ભાજપ સરકારમાં ગુજરાત રોજગારીમાં પ્રથમ નંબરે છે. તે હકીકત છે.

કોંગ્રેસના જૂઠ્ઠા આક્ષેપોનો જવાબ આપતાં શ્રી ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં ક્યારેય નિયમિત રીતે ભરતી યોજતી ન હતી. જે નોકરીમાં નિમણુંક કરવામાં આવતી હતી તે પારદર્શક ન હતી. જેનાથી લાખો હોંશિયાર યુવાનોને અન્યાય થતો હતો. જ્યારે ભાજપના શાસનમાં દર વર્ષે પ્રાઈવેટ સેક્ટર માટે રોજગારી મેળા પ્રતિ વર્ષે યોજીને છેલ્લા પાંચ વર્ષમાં ૫,૨૬૯ ભરતી મેળા યોજીને ૧૦,૦૯,૬૫૨ લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડી છે. એટલું જ નહીં સરકારી ક્ષેત્રમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભરતી યોજવામાં આવતી હોય છે. ગયા વર્ષે ૧,૦૦,૦૦૦ સરકારી નોકરી અપવામાં આવી હતી. આ વર્ષે સતત ભરતીની પ્રક્રિયા ચાલુ છે. તેમજ મુદ્રા યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં છેલ્લા ૪ વર્ષમાં ૪૪,૨૦,૬૨૩થી વધુ લાભાર્થીઓને રૂ.૩૦,૪૬૮ કરોડનું ધિરાણ કરીને લાભાર્થીઓને પગભર કરવામાં આવ્યાં છે.



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

..૨..

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં યોજાયેલ ભરતી મેળાની વિગત

વર્ષ	યોજવામાં આવેલ ભરતી મેળાની સંખ્યા	ભરતી મેળામાં હાજર રહેલ ઉમેદવારોની સંખ્યા	હાજર રહેલ નોકરીદાતાની સંખ્યા	ભરતી મેળામાં પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યા
૨૦૧૩	૧,૧૦૭	૨,૬૫,૦૭૬	૨,૫૫૮	૧,૫૧,૩૮૩
૨૦૧૪	૧,૧૧૧	૨,૫૫,૮૪૪	૩,૨૬૮	૧,૬૦,૦૮૮
૨૦૧૫	૧,૧૩૫	૨,૭૦,૧૫૦	૨,૮૦૮	૧,૭૭,૬૮૪
૨૦૧૬	૧,૩૦૭	૩,૭૭,૮૮૬	૩,૮૦૨	૨,૩૮,૮૪૦
૨૦૧૭	૬૦૮	૪,૮૦,૬૩૧	૬,૩૬૦	૨,૮૧,૬૩૬
૨૦૧૮ (ઓક્ટોબર-૧૮ સુધી)	૭૫૮	૩,૩૫,૧૮૪	૫,૮૭૨	૧,૮૪,૫૭૩

શ્રી પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે સરકારી નોકરીની ભરતી બહાર પડે એટલે યુવાન, યુવતીઓ દ્વારા અરજી કરવામાં આવે તે સ્વાભાવિક છે. દરેક ને સરકારી નોકરી મળે તેવી વધુ ઈચ્છા હોય છે. તે તેમનો અધિકાર પણ છે. તે અધિકારને કોંગ્રેસ સંખ્યાત્મક રીતે દર્શાવીને ઉશ્કેરાટ અને અપ્રચાર ફેલાવવામાં ઉપયોગ ન કરવો જોઈએ.

કોંગ્રેસ પારદર્શકતાનો વિરોધ કરે છે. કોંગ્રેસ ભ્રષ્ટાચાર સામે એકશનનો વિરોધ કરે છે. કોંગ્રેસે ભૂતકાળમાં વાઈબ્રન્ટનો વિરોધ કરીને ગુજરાતમાં મૂડીરોકાણ ન આવે તેવાં પડયંત્રો રચ્યા હતાં. હવે સરકારનાં નોકરી આપવાનાં પ્રયાસની પણ કોંગ્રેસનિંદા કરે તે યોગ્ય નથી. કોંગ્રેસની મેન્ટાલીટી સંપૂર્ણ નકારાત્મક અને ખંડનાત્મક છે. ગુજરાત રોજગારીનાં આંકડાઓ ધ્યાનમાં લીધાં વગર અપ્રચાર કરીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસને ગુજરાતનાં હિતમાં નહીં ગુજરાતને બદનામ કરવામાં રસ છે.

શ્રી પંડ્યાએ કોંગ્રેસનાં વિપક્ષના નેતાશ્રીને જવાબ આપતાં જણાવ્યું હતું, કે પેપરલીક કમનસીબ અને પીડાદાયક ઘટના છે, પરંતુ પુનઃપરીક્ષા લેવાનાં નિર્ણય અને કસૂરવારોને પકડીને ગેરરીતી કરનારા ગુનેગારોનું નસીબ ફૂટ્યું છે. સરકાર કોઈ પણ સંજોગોમાં ગુનેગારોને છોડવાની નથી. હોશિયાર, પરીશ્રમી અને પ્રમાણિક લોકોનાં નસીબને સરકારે પુનઃપરીક્ષા માટે અકબંધ રાખ્યું છે. કોઈપણ શહેશાહ રાખ્યાં વગર એક પછી એક ગુનેગાર પકડાઈ રહ્યાં છે. પોલીસ તંત્ર દ્વારા રોજરોજ સંપૂર્ણ પારદર્શકતાથી મીડીયા દ્વારા સમગ્ર ઘટનાક્રમ જનતા સમક્ષ મૂકવામાં આવી રહ્યો છે.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ



પ્રેસનોટ- ૦૨

તા.૦૫.૧૨.૨૦૧૮

વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી અને શ્રી હાર્દિકભાઈની મુલાકાત એ “ફિક્સ મેચ” છે. તેઓ અંદરોઅંદર ભલે રમત રમે પરંતુ ગુજરાતની જનતા સાથે હવે રમત ન રમે - ભરત પંડ્યા

ગુજરાતમાં જ્ઞાતિ વિગ્રહ અને વેરઝેરનો કોંગ્રેસ ખતરનાક ખેલ ખેલી રહી છે શ્રી હાર્દિકને ચેતવાની જરૂર છે. દેશમાં સૌથી પહેલા ભાજપે ગુજરાતમાં ૧૦ ટકા ઈબીસી (આર્થિક પછાત અનામત) આપવાની જાહેરાત કરીને તેનો અમલ શરૂ કર્યો ત્યારે તેને કોંગ્રેસે સમર્થન આપ્યું ન હતું.

કોંગ્રેસના વિપક્ષ નેતાએ વિધાનસભામાં પહેલા ૧૫ ટકા ઈબીસી ખાનગી બિલ મૂક્યું. કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓએ ૨૦ ટકા ઈબીસીની ગુજરાતમાં જાહેરાત કરી. અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોંગ્રેસ ૧ ટકો પણ ઈબીસી જાહેર કરતી નથી. કોંગ્રેસના દેખાડવાનાં અને ચાવવાનાં દાંત જુદા છે.

ભાજપે જાહેર કરેલ ૧૦ ટકા ઈબીસીના સમર્થનમાં કોંગ્રેસ સુપ્રિમ કોર્ટમાં કેમ જોઈંટ પીટીશન કરતી નથી ?
- ભરત પંડ્યા

ભાજપના પ્રદેશ પ્રવક્તાશ્રી ભરત પંડ્યાએ વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી અને શ્રી હાર્દિકભાઈની મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, તેઓ ફિક્સ મેચ રમે છે. તેઓ અંદરો અંદર ભલે રમત રમે પરંતુ ગુજરાતની જનતા સાથે હવે રમત ન રમે તેવી મારી નમ્ર અપીલ છે.

કોંગ્રેસની ભયંકર રમત સામે શ્રી હાર્દિકને ચેતવતાં શ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ તમારી સાથે સંપૂર્ણ રમત રમે છે અને ગુજરાતમાં જ્ઞાતિ વિગ્રહ અને વેરઝેરનો કોંગ્રેસ ખતરનાક ખેલ ખેલી રહી છે તેનાથી ચેતવાની જરૂર છે. આ અગાઉ વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસના કાર્યાલયમાં શ્રી કપિલ સિબ્બલ અને કોંગ્રેસની ટીમની અડધી રાતે રાહ જોયા પછી પણ કોંગ્રેસે સમાજને અનામત માટે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. પત્રકારોને આખી રાત જાગવું પડ્યું હતું. કોંગ્રેસે ક્યારે પાટીદાર સમાજને અનામત આપવા બાબતે ક્યારેય કોઈ સ્ટેન્ડ લીધો નથી. જ્યારે ભાજપે ૧૦ ટકા ઈબીસી, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, બિન અનામત આર્થિક નિગમ, મા અમૃતમ સહિત અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.

શ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપે દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં ૧૦ ટકા ઈબીસી (આર્થિક પછાત અનામત) આપવાની જાહેરાત કરીને તેનો અમલ શરૂ કર્યો હતો. તેને કોંગ્રેસે સમર્થન આપ્યું નહીં. પરંતુ તેમાં કોંગ્રેસના ઈશારે વિધન સંતોષી લોકોએ અટકાવવા પ્રયાસ કર્યો અને તે સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પેંડિંગ છે. કોંગ્રેસના વિપક્ષ નેતાએ વિધાનસભામાં પહેલા ૧૫ ટકા ઈબીસી ખાનગી બિલ મૂક્યું. કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓએ ૨૦ ટકા ઈબીસીની ગુજરાતમાં જાહેરાત કરી અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોંગ્રેસ ૧ ટકો પણ ઈબીસી જાહેર કરતી નથી. ભાજપે જાહેર કરેલ ૧૦ ટકા ઈબીસીના સમર્થનમાં કોંગ્રેસ સુપ્રિમ કોર્ટમાં જોઈંટ પીટીશન કરતી નથી. કોંગ્રેસના દેખાડવાનાં અને ચાવવાનાં દાંત જુદા છે તે ગુજરાતની જનતા જાણી ચૂકી છે.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ